

Signature of Invigilators

Roll No.

--	--	--	--	--

1.

PHYSICAL EDUCATION

(In figures as in Admit Card)

2.

Paper - II

Roll No.

(In words)

D/03/21

Name of the Areas/Section (if any)

Time Allowed : 75 Minutes]

[Maximum Marks : 100

Instructions for the Candidates

1. Write your Roll Number in the space provided on the top of this page.
2. This paper consists of *fifty (50)* multiple choice type questions. *All* questions are compulsory.
3. Each item has upto four alternative responses marked (A), (B), (C) and (D). The answer should be a capital letter for the selected option. The answer letter should entirely be contained within the corresponding square.

Correct method Wrong Method or

4. Your responses to the items for this paper are to be indicated on the ICR Answer Sheet under paper II only
5. Read instructions given inside carefully.
6. One sheet is attached at the end of the booklet for rough work.
7. You should return the test booklet to the invigilator at the end of paper and should not carry any paper with you outside the examination hall.


પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ :

૧. આ પાનાની ટોચમાં દર્શાવેલી જગ્યામાં તમારો રોલ નંબર લખો.
૨. આ પ્રશ્નપત્રમાં કુલ પચાસ (50) બહુવૈકલ્પિક ઉત્તરો ધરાવતા પ્રશ્નો આપેલા છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
૩. પ્રત્યેક પ્રશ્ન વધુમાં વધુ ચાર બહુવૈકલ્પિક ઉત્તરો ધરાવે છે. જે (A), (B), (C) અને (D) વડે દર્શાવવામાં આવ્યા છે. પ્રશ્નનો ઉત્તર કેપીટલ સંજ્ઞા વડે આપવાનો રહેશે. ઉત્તરની સંજ્ઞા આપેલ ખાનામાં બરાબર સમાઈ જાય તે રીતે લખવાની રહેશે.

ખરી રીત : ખોટી રીત : ,

૪. આ પ્રશ્નપત્રના જવાબ આપેલ ICR Answer Sheetના Paper II વિભાગની નીચે આપેલ ખાનાઓમાં આપવાના રહેશે.
૫. અંદર આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
૬. આ બુક્લેટની પાછળ આપેલું પાનું રફ કામ માટે છે.
૭. પરીક્ષાસમય પૂરો થઈ ગયા પછી આ બુક્લેટ જે તે નિરીક્ષકને સોંપી દેવી. કોઈ પણ કાળજી પરીક્ષાખંડની બહાર લઈ જવો નહીં.

SEAL



PHYSICAL EDUCATION

શારીરિક શિક્ષણ

PAPER-II

પ્રશ્નપત્ર-II

Note :— (i) This paper contains fifty (50) multiple-choice, true or false and matching type questions.

(ii) Attempt all questions.

(iii) Each question carries two (2) marks.

સૂચના : (i) આ પ્રશ્નપત્રમાં પચાસ (૫૦) બહુવિકલ્પીય પ્રશ્નો, સાચું-ખોટું અને જોડકાં બનાવવાના પ્રશ્નો છે.

(ii) તમામ પ્રશ્નોના જવાબ લખવાના છે.

(iii) પ્રત્યેક પ્રશ્નના બે (૨) ગુણ છે.

1. 'Sprain' is an injury to :

(A) Muscle

(B) Bone

(C) Ligaments

(D) Skin

સ્પ્રેઇનની ઈજા ઓળખાય છે :

(A) સ્નાયુની ઈજા

(B) હાડકાની ઈજા

(C) લીગામેન્ટ્સની ઈજા

(D) ચામડીની ઈજા

2. 'Rehabilitation' of sports injuries is done using :

(A) Calisthenics

(B) Corrective exercises

(C) Treatment of Wound

(D) None of these

રમતગમતની ઈજામાંથી પુનર્વાસ દરમ્યાન ઉપયોગ કરવામાં આવે છે :

(A) કેલેસ્થેનિક્સ

(B) સુધારણા કસરતો

(C) ઘાની સારવાર

(D) એમાંથી કોઈ નહિ

3. 'Biceps' is a :

(A) Involuntary muscle

(B) Voluntary muscle

(C) Cardiac muscle

(D) None of these

દ્વિમસ્તક સ્નાયુ છે :

(A) અનૈચ્છીક સ્નાયુ

(B) ઐચ્છીક સ્નાયુ

(C) કાર્ડિઅક સ્નાયુ

(D) એમાંથી કોઈ નહિ

4. The main 'postural deformity' among young girls is :

(A) Kyphosis

(B) Lordosis

(C) Scoliosis

(D) Flat-feet

યુવાન છોકરીઓમાં મુખ્ય શરીર વિકૃતિ જોવા મળે છે :

(A) કાયફોસીસ

(B) લાર્ડોસીસ

(C) સ્કોલીઓસીસ

(D) સપાટ પગ

5. Absorption of 'fat' takes place in :
- (A) Mouth (B) Large intestine
(C) Small intestine (D) Liver
- ચરબી ભરાવો આ જગ્યાએ થાય છે :
- (A) મોંઢામાં (B) મોટા આંતરડામાં
(C) નાના આંતરડામાં (D) લીવરમાં
6. The instrument used for estimation of 'Body Fat' is :
- (A) Flexometer (B) Goniometer
(C) Dynamometer (D) Skin-fold caliper
- શરીરની ચરબી માપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે :
- (A) ફ્લેક્સોમીટર (B) ગોનીયોમીટર
(C) ડાયનેમોમીટર (D) સ્કીનફોલ્ડ કેલીપર
7. The upper reading of 'blood pressure' is called :
- (A) Diastolic pressure (B) Systolic pressure
(C) Hypertension (D) Hypotension
- લોહીના દબાણનું ઊંચો આંક આ નામે ઓળખાય છે :
- (A) ડાયસ્ટોલીક દબાણ (B) સીસ્ટોલીક દબાણ
(C) હાયપરટેન્સન (D) હાયપોટેન્સન
8. The term 'Aerobic' means :
- (A) Exercise without Oxygen
(B) Exercise in the presence of Oxygen
(C) Exercise in the presence of Carbon di-oxide
(D) Exercise in the presence of Hydrogen
- 'એરોબિક' શબ્દનો અર્થ :
- (A) ઓક્સીજન વગર કરાવતો
(B) ઓક્સીજનની હાજરી સાથે કરાવતો
(C) કાર્બન ડાયોક્સાઈડની હાજરી સાથે કરાવતો
(D) હાયડ્રોજનની હાજરી સાથે કરાવતો
9. Which of the following is 'Hinge' joint ?
- (A) Shoulder joint (B) Ankle joint
(C) Hip joint (D) Knee joint
- નીચેનામાંથી મજાગરા સાંધો કયો છે :
- (A) ખભાનો સાંધો (B) ઘૂંટીનો સાંધો
(C) થાપાનો સાંધો (D) ઘૂંટણનો સાંધો

10. 'Physiology' deals with :
- | | |
|--------------------------|--------------------------|
| (A) Skeleton of the body | (B) Weight of the body |
| (C) Length of the body | (D) Function of the body |

ફિઝિયોલોજી સંબંધ ધરાવે છે :

- | | |
|-----------------------|------------------------|
| (A) શરીરની રચના સાથે | (B) શરીરનું વજન સાથે |
| (C) શરીરની લંબાઈ સાથે | (D) શરીરના કાર્યો સાથે |

11. Shape of the body largely depends upon :

- | | |
|-------------|--------------|
| (A) Muscles | (B) Skin |
| (C) Organs | (D) Skeleton |

શરીરના દેખાવનો મુખ્યત્વે આધાર છે :

- | | |
|-------------|--------------|
| (A) સ્નાયુઓ | (B) ચામડી |
| (C) અવયવો | (D) હાડપિંજર |

12. Doping test was started in :

- | | |
|----------|----------|
| (A) 1957 | (B) 1961 |
| (C) 1981 | (D) 1980 |

ડોપિંગ ટેસ્ટની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી :

- | | |
|----------|-----------|
| (A) 1957 | (B) 1961 |
| (C) 1981 | (D) 1980. |

13. Deficiency of Vitamin 'D' causes :

- | | |
|--------------------|------------------|
| (A) Beriberi | (B) Rickets |
| (C) Nightblindness | (D) All of these |

વિટામીન 'ડી' ની ઉણપને કારણે થાય છે :

- | | |
|-----------------|-----------------|
| (A) બેરી.બેરી | (B) રિકેટ્સ |
| (C) રતાંધળાપણું | (D) એમાંના બધાજ |

14. The best method for training of emotions in sports is :

- | | |
|----------------|-----------------|
| (A) Repression | (B) Redirection |
| (C) Inhibition | (D) Sublimation |

રમતગમતમાં સંવેગોની તાલીમ માટે ઉત્તમ પદ્ધતિ છે :

- | | |
|-----------------|-----------------|
| (A) સિપ્રેશન | (B) રીડાયરેક્શન |
| (C) ઈન્હીબીટેશન | (D) સબ્લીમેશન |

15. These are the conditions related with stress *except* :
- | | |
|--------------------|------------------|
| (A) Hypertension | (B) Anemia |
| (C) Mental illness | (D) Peptic ulcer |
- તાણને જન્મ આપનાર પરિસ્થિતિ :
- | | |
|-------------------|-------------------|
| (A) ઉચ્ચ તણાવ | (B) લોહીની ખામી |
| (C) માનસિક બીમારી | (D) પેપ્ટિક અલ્સર |
16. Human behaviour is a :
- | | |
|-----------------------------|----------------------------|
| (A) Very complex phenomenon | (B) Very simple phenomenon |
| (C) Very general phenomenon | (D) None of these |
- માનવ વર્તુણક એટલે :
- | | |
|-----------------------|--------------------|
| (A) ખૂબજ જટીલ બનાવ | (B) ખૂબજ સરળ બનાવ |
| (C) ખૂબજ સામાન્ય બનાવ | (D) એમાંથી કોઈ નહિ |
17. Psycho-sexual Development takes place during :
- | | |
|---------------------|-----------------|
| (A) Later Childhood | (B) Adolescence |
| (C) Young age | (D) Adulthood |
- મનો-જાતિય વિકાસનો પ્રારંભ આ દરમ્યાન થાય છે :
- | | |
|-----------------------|-----------------|
| (A) ઉત્તર બાલ્યાવસ્થા | (B) કિશોરાવસ્થા |
| (C) યુવાવસ્થા | (D) પુખ્તાવસ્થા |
18. Introverts are interested in :
- | | |
|---------------------------|-------------------|
| (A) Themselves | (B) Others |
| (C) Themselves and others | (D) None of these |
- આંતરમુખી વ્યક્તિ રસ ધરાવે છે :
- | | |
|----------------------------|----------------------|
| (A) પોતાનામાં | (B) બીજાઓમાં |
| (C) પોતાનામાં અને બીજાઓમાં | (D) એમાંથી કોઈપણ નહિ |
19. In 400 metres race in standard track, strager is given :
- | | |
|----------------------------|------------------|
| (A) $1/2$ strager | (B) Full strager |
| (C) $1\frac{1}{2}$ strager | (D) 2 stragers |
- પ્રમાણભૂત ટ્રેકમાં ૪૦૦ મી દોડ માટે ચકાવા (સ્ટ્રેગર સ્ટાન્સ) આપવામાં આવે છે :
- | | |
|----------------------|----------------------|
| (A) અર્ધ ચકાવા અંતર | (B) પૂર્ણ ચકાવા અંતર |
| (C) દોહું ચકાવા અંતર | (D) બમણુ ચકાવા અંતર |
20. Maulana Abul Kalam Azad Trophy is awarded to :
- | | |
|----------------|------------|
| (A) College | (B) State |
| (C) University | (D) School |
- મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવે છે :
- | | |
|------------------------|----------------------|
| (A) કોલેજ કક્ષા માટે | (B) રાજ્ય કક્ષા માટે |
| (C) વિશ્વવિદ્યાલય માટે | (D) શાળા કક્ષા માટે |

21. What is meant by seeded player ?
 (A) a raw player
 (B) a physically challenged player
 (C) a player asked to play at an advanced stage of the tournament
 (D) a player under-training

સીડેડ ખેલાડીનો અર્થ શું છે ?

- (A) નવો ખેલાડી
 (B) શારીરિક અશક્ત ખેલાડી
 (C) ટુર્નામેન્ટમાં આગળના તબક્કામાં રમવાનું જણાય તે ખેલાડી
 (D) તાલીમ લેતો ખેલાડી

22. Shuttle run mainly measures :

- (A) Speed (B) Strength
 (C) Agility (D) Endurance

શટલ રન મુખ્યત્વે માપન કરે છે :

- (A) ઝડપ (B) તાકાત
 (C) ચપલતા (D) સહનશક્તિ

23. The aim of the National Council of Teacher Education (NCTE) is :

- (A) To improve the quality of teacher education
 (B) To improve the quality of medical education
 (C) To improve the quality of engineering education
 (D) To improve the quality of general education

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (એન.સી.ટી.ઈ.) નો મુખ્ય હેતુ :

- (A) તાલીમી શિક્ષણની ગુણવત્તા સુધારવા
 (B) તબીબી શિક્ષણની ગુણવત્તા સુધારવા
 (C) ઈજનેરી શિક્ષણની ગુણવત્તા સુધારવા
 (D) સામાન્ય શિક્ષણની ગુણવત્તા સુધારવા

24. Name the First Indian Swimmer to swim across the English Channel :

- (A) Thomas Cook (B) Khazan Singh
 (C) Mihir Sen (D) Subestian Xaviers

અંગ્રેજી ખાડી તરીકે પસાર કરનાર પ્રથમ ભારતીય તરનારનું નામ :

- (A) થોમસ કુક (B) ખજાનસીંગ
 (C) મિહિર સેન (D) સ્બાસ્ટીન ઝેવીયર્સ

25. Which of the following is *not* related to Football ?
 (A) Thomas Cup (B) FIFA Cup
 (C) Durand Cup (D) Santosh Trophy
 નીચેનામાંથી કઈ બાબતનો ફૂટબોલ સાથે સંબંધ નથી :
 (A) થોમસ કપ (B) ફીફા કપ
 (C) ડુરાન્ડ કપ (D) સંતોષ ટ્રોફી
26. Aim of Physical Education is :
 (A) To develop body muscles (B) To develop total personality
 (C) To develop human behaviour (D) To develop mind
 શારીરિક શિક્ષણનું ધ્યેય :
 (A) શરીરના સ્નાયુઓનો વિકાસ (B) સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ
 (C) માનવ વર્તનનો વિકાસ (D) મનનો વિકાસ
27. Agha Khan Cup is associated with :
 (A) Football (B) Hockey
 (C) Golf (D) Cricket
 આગાખાન કપ જોડાયેલ છે :
 (A) ફૂટબોલ (B) હોકી
 (C) ગોલ્ફ (D) ક્રિકેટ
28. Fastest game of the world is :
 (A) Ice-Hockey (B) Basket-ball
 (C) Football (D) Squash-Racket
 વિશ્વની સૌથી ઝડપી રમત :
 (A) આઈસ હોકી (B) બાસ્કેટ બોલ
 (C) ફૂટબોલ (D) સ્ક્વોશ રેકટ
29. Which of the following is *not* included in the Olympic Games ?
 (A) Track and field (B) Rowing
 (C) Archery (D) Rugby
 ઓલિમ્પિક રમતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી :
 (A) ટ્રેક એન્ડ ફિલ્ડ (B) રોવિંગ
 (C) આર્ચરી (D) રગ્બી
30. Which country led the boycott of 1980 Olympic Games held at Moscow ?
 (A) Great Britain (B) China
 (C) United States (D) South Korea
 મોસ્કોમાં 1980 માં યોજાયેલ ઓલિમ્પિક્સમાં બહિસ્કારનો કયા દેશે નેતૃત્વ લીધું હતું :
 (A) ગ્રેટ બ્રિટન (B) ચીન
 (C) યુનાઈટેડ સ્ટેટ્સ (D) દક્ષિણ કોરીયા

31. Headquarters of International Olympic Committee is located at :

- (A) India (B) Switzerland
(C) U.S.A. (D) England

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિનું મુખ્ય મથક ક્યાં આવેલું છે :

- (A) ભારત (B) સ્વીટ્ઝરલેન્ડ
(C) યુ.એસ.એ. (D) ઈંગ્લેન્ડ

32. Lakshmibai College of Physical Education was established in :

- (A) 1897 (B) 1957
(C) 1857 (D) 1950

લક્ષ્મીબાઈ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનો પ્રારંભ ક્યારે થયો હતો :

- (A) 1897 (B) 1957
(C) 1857 (D) 1950

33. Micro-cycle involves training of :

- (A) 6-8 weeks (B) One month
(C) 8-10 weeks (D) One week

માઈક્રો સાયકલનો તાલીમ સમય :

- (A) 6 થી 8 અઠવાડિયા (B) એક મહિનો
(C) 8 થી 10 અઠવાડિયા (D) એક અઠવાડિયું

34. Which method is useful in teaching Physical Education ?

- (A) Lecture method (B) Command method
(C) Discussion method (D) All of these

શારીરિક શિક્ષણનું શિક્ષણ આપવામાં કઈ પદ્ધતિ ઉપયોગી છે :

- (A) વ્યાખ્યાન પદ્ધતિ (B) હુકમ પદ્ધતિ
(C) ચર્ચા પદ્ધતિ (D) એમાંની બધીજ પદ્ધતિઓ

35. Physical Fitness Component is :

- (A) Cardiovascular endurance (B) Flexibility
(C) Strength (D) All of these

શારીરિક ક્ષમતાના પરિબળો :

- (A) કાર્ડિઓવસ્ક્યુલર એન્ડ્યુરેન્સ (B) ફ્લેક્સીબીલીટી
(C) સ્ટ્રેન્થ (D) એમાંના બધા

36. Sports management is :

- (A) An art (B) A science
(C) Both as above (D) None of these

ખેલ પ્રબંધન કહેવાય છે :

- (A) કળા (B) વિજ્ઞાન
(C) એમાંના બન્ને (D) એમાંના કોઈ નહિ

37. Newton's Second Law is known as :

- (A) Law of action and reaction (B) Law of acceleration
(C) Law of gravity (D) Law of inertia

ન્યુટનનો ગતિનો બીજા નિયમ :

- (A) આઘાત પ્રત્યાઘાતનો નિયમ (B) પ્રવેગનો નિયમ
(C) ગુરૂત્વાકર્ષણનો નિયમ (D) જડત્વનો નિયમ

38. AAPHERD test is used to measure :

- (A) Psychological fitness (B) Muscular fitness
(C) Cardiac fitness (D) General fitness

આઈર્ડ ટેસ્ટનો ઉપયોગ માપવામાં આવે છે :

- (A) માનસિક ક્ષમતા (B) સ્નાયુચિક ક્ષમતા
(C) હૃદયની ક્ષમતા (D) સામાન્ય ક્ષમતા

39. Research proposal is also called as :

- (A) Abstract (B) Summary
(C) Synopsis (D) Methodology

રીસર્ચ પ્રપોઝલ આ પ્રમાણે પણ ઓળખાય છે :

- (A) એબસ્ટ્રેક્ટ (B) સમરી
(C) સીનોપસિસ (D) મેથેડોલોજી

40. Which of the following instruments comes under the purview of Anthropometry ?

- (A) Ultrasound (B) Treadmill
(C) Dynamometer (D) Skinfold Caliper

નીચેના સાધનોમાંથી શરીરઅંગ માપનના ક્ષેત્રમાં આવે છે :

- (A) અલ્ટ્રાસાઉન્ડ (B) ટ્રેડમિલ
(C) ડાયનેમોમીટર (D) સ્કીનફોલ્ડ કેલીપર

41. Human body has two types of muscles.
 (A) True (B) False
 (C) Partly true (D) Partly false

માનવ શરીરમાં બે પ્રકારના સ્નાયુ હોય છે.

- (A) સાચું (B) ખોટું
 (C) આંશિક સાચું (D) આંશિક ખોટું

42. Super-compensation means adaptation to fatigue.
 (A) True (B) False
 (C) Partly true (D) Partly false

સુપર કોમ્પેન્સેશન એટલે થાક સાથે અનુકુલન.

- (A) સાચું (B) ખોટું
 (C) આંશિક સાચું (D) આંશિક ખોટું

43. Number of hurdles in 400 metres race are ten.
 (A) True (B) False
 (C) Partly true (D) Partly false

400 મી વિદનદોડમાં વિદનની સંખ્યા દસ હોય છે.

- (A) સાચું (B) ખોટું
 (C) આંશિક સાચું (D) આંશિક ખોટું

44. The Javelin thrown at an angle of 30° covers maximum distance.
 (A) True (B) False
 (C) Partly true (D) Partly false

30° ખૂણેથી ફેંકવામાં આવતી બરછી વધારેમાં વધારે અંતર પ્રાપ્ત કરે છે.

- (A) સાચું (B) ખોટું
 (C) આંશિક સાચું (D) આંશિક ખોટું

45. Spirometer is used to measure blood pressure.
 (A) True (B) False
 (C) Partly true (D) Partly false

સ્પાયરોમીટરનો ઉપયોગ લોહીનું દબાણ માપવા માટે થાય છે.

- (A) સાચું (B) ખોટું
 (C) આંશિક સાચું (D) આંશિક ખોટું

Note :— Answer the questions 46 to 50 by matching List I with List II and select the correct answer using the codes given below the lists.

સૂચના :—પ્રશ્ન નંબર 46 થી 50 ના જવાબો યાદિ I ને યાદિ II સાથે જોડી કોડમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

46.	List I	List II
(a)	W.F.I.	(1) Swimming
(b)	S.F.I.	(2) Archery
(c)	A.A.I.	(3) Wrestling
(d)	A.A.F.I.	(4) Athletics
		(5) Basket-ball

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(3)	(1)	(5)
(B)	(3)	(1)	(2)	(4)
(C)	(1)	(4)	(3)	(2)
(D)	(5)	(2)	(4)	(1)

યાદિ I

- (a) ડબલ્યુ.એફ.આઈ.
 (b) એસ.એફ.આઈ.
 (c) એ.એ.આઈ.
 (d) એ.એ.એફ.આઈ.

યાદિ II

- (1) સ્વીમીંગ
 (2) આર્ચરી
 (3) રેસલ્લીંગ
 (4) એથલેટિક્સ
 (5) બાસ્કેટબોલ

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(3)	(1)	(5)
(B)	(3)	(1)	(2)	(4)
(C)	(1)	(4)	(3)	(2)
(D)	(5)	(2)	(4)	(1)

47.

List I

- (a) Abduction
- (b) Adduction
- (c) Pronation
- (d) Supination

List II

- (1) Movement away from the midline of the body
- (2) Turning palm downwards
- (3) Turning palm upwards
- (4) Rotation on axis
- (5) Movement towards midline of the body

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(2)	(3)	(4)	(5)
(C)	(3)	(4)	(5)	(1)
(D)	(5)	(1)	(2)	(3)

યાદિ I

- (a) એબ્ડેક્શન
- (b) એડેક્શન
- (c) પ્રોનેશન
- (d) સુપિનેશન

યાદિ II

- (1) શરીરના મધ્ય રેખાથી દૂરની ગતિ
- (2) હથેલી નીચેની તરફ ફેરવવી
- (3) હથેલી ઉપરની તરફ ફેરવવી
- (4) ઘરી ઉપર ફરવું
- (5) શરીરની મધ્યરેખા તરફ ગતિ

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(2)	(3)	(4)	(5)
(C)	(3)	(4)	(5)	(1)
(D)	(5)	(1)	(2)	(3)

48.

List I

- (a) Aquatics
- (b) Athletics
- (c) Basketball
- (d) Archery

List II

- (1) Binamol
- (2) Limba Ram
- (3) Karni Singh
- (4) Khajan Singh
- (5) Kirit Oza

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(3)	(4)	(1)
(B)	(4)	(1)	(5)	(2)
(C)	(3)	(2)	(1)	(4)
(D)	(5)	(3)	(2)	(1)

याद्वि I

- (a) तरश
- (b) अथ्लेटिक्स
- (c) बास्केटबोल
- (d) तिरंदाज

याद्वि II

- (1) बीना भोल
- (2) लिम्बा राम
- (3) करनी सिंग
- (4) पञ्जन सिंग
- (5) किरिट ओजा

कोड :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(3)	(4)	(1)
(B)	(4)	(1)	(5)	(2)
(C)	(3)	(2)	(1)	(4)
(D)	(5)	(3)	(2)	(1)

49.

List I
(Olympic Games)

List II
(Year)

- | | |
|-------------|----------|
| (a) Tokyo | (1) 1980 |
| (b) Seoul | (2) 1996 |
| (c) Moscow | (3) 1964 |
| (d) Atlanta | (4) 1988 |
| | (5) 1972 |

Code :

- | | | | | |
|-----|-----|-----|-----|-----|
| | (a) | (b) | (c) | (d) |
| (A) | (3) | (4) | (1) | (2) |
| (B) | (1) | (2) | (3) | (4) |
| (C) | (4) | (1) | (2) | (3) |
| (D) | (2) | (3) | (5) | (4) |

याद्वि I
(ओलडडडडड रडतु)

याद्वि II
(वर्ष)

- | | |
|----------------|----------|
| (a) टुडुडुडु | (1) 1980 |
| (b) सुडुडुडु | (2) 1996 |
| (c) डुडुडुडु | (3) 1964 |
| (d) डुडुडुडुडु | (4) 1988 |
| | (5) 1972 |

डुडु :

- | | | | | |
|-----|-----|-----|-----|-----|
| | (a) | (b) | (c) | (d) |
| (A) | (3) | (4) | (1) | (2) |
| (B) | (1) | (2) | (3) | (4) |
| (C) | (4) | (1) | (2) | (3) |
| (D) | (2) | (3) | (5) | (4) |

50.

List I

- (a) Badminton
- (b) Basketball
- (c) Swimming
- (d) Billiards

List II

- (1) Jump ball
- (2) Let
- (3) Cue
- (4) Pitch
- (5) Breast stroke

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(5)	(2)	(3)
(B)	(3)	(1)	(4)	(2)
(C)	(2)	(1)	(5)	(3)
(D)	(4)	(3)	(2)	(1)

याद्वि I

- (a) बेडमिंटन
- (b) बास्केटबोल
- (c) स्वीमिंग
- (d) बीलीयार्ड

याद्वि II

- (1) जम्पबोल
- (2) लेट
- (3) क्यु
- (4) पीच
- (5) ब्रेस्ट स्ट्रोक

कोड :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(5)	(2)	(3)
(B)	(3)	(1)	(4)	(2)
(C)	(2)	(1)	(5)	(3)
(D)	(4)	(3)	(2)	(1)

ROUGH WORK

ROUGH WORK

SEAL